

# S.D.ARTS & B.R.COMMERCE COLLEGE,MANSA

UGBA SEM-V [Gujarati] core Paper-301-(2021)

MCQ- Prepared By Assi. Prof. Hemlataben B. Mehta

પ્રશ્નોનો અને તેનાં જવાબ

૧. સુધારકયુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? - નર્મદયુગ
૨. દલપતરામનો જન્મ કઈ સાલમાં થયો હતો ? - ઇ.સ. ૧૮૨૦
૩. દલપતરામના જન્મનું સ્થળ જણાવો .- વઢવાણ (સુરેન્દ્રનગર)
૪. દલપતરામને અંગ્રેજી સાહિત્યનો પરિચય કોના દ્વારા થયો હતો? - ફાર્બસ સાહેબ
૫. કયા ગુજરાતી કવિની કવિતામાં ઉખાણાં અને હડ્ડલાનો સમાવેશ થાય છે. - દલપતરામ
૬. દલપતરામ કૃત 'વેનચરિત' કેવા પ્રકારનું કાવ્ય છે? - આખ્યાન
૭. 'મિથ્યાભિમાન' નાટકના સર્જકનું નામ જણાવો. - દલપતરામ
૮. 'મિથ્યાભિમાન' નાટકમાં 'રતાંધણો' કોણ છે? - જીવરામભટ્ટ
૯. 'મિથ્યાભિમાન' નાટકનું મુખ્ય પાત્ર કોણ છે? - જીવરામભટ્ટ
૧૦. દલપતરામને 'કવીશ્વર' નું બિરુદ કોણે આપ્યું ? - કિન્લોક ફાર્બસ સાહેબે
૧૧. અર્વાચીન ગુજરાતી કવિતાની પહેલી કૃતિ કઈ છે? - દલપતરામ કૃત- 'બાપાની પીંપળ' (ઇ.સ.૧૮૪૫)
૧૨. 'ભૂતનિબંધ'ના લેખકનું નામ જણાવો. - દલપતરામ
૧૩. નર્મદ કયાંના વતની હતા ? - સુરત
૧૪. નર્મદના જન્મની સાલ જણાવો - (ઇ.સ.૧૮૩૩)
૧૫. " સૌ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો,ફતેહ છે આગે. -આ પંક્તિ કયા કવિની છે? - નર્મદ
૧૬. અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથાનું નામ જણાવો. - નર્મદ કૃત 'મારી હકીકત'
૧૭. નર્મદે કયુ સામાયિક પ્રકાશિત કરેલ? - 'ડાંડિયો'
૧૮. ગુજરાતી કવિતામા પ્રકૃતિને સ્વતંત્ર વિષય તરીકે સૌ પ્રથમ કયા કવિએ સ્થાન આપ્યું? - નર્મદ
૧૯. 'મારી હકીકત'આત્મકથાના સર્જકનું નામ જણાવો. - નર્મદ
૨૦. નવલરામના જન્મની સાલ જણાવો - (ઇ.સ.૧૮૩૬)
૨૧. નવલરામે કયુ સામાયિક ચલાવ્યું હતું? - 'ગુજરાત શાળાપત્ર'
૨૨. 'ભટ્ટનું ભોપાળુ' ના રચયિતાનું નામ આપો - નવલરામ
૨૩. 'ભટ્ટનું ભોપાળુ' નાટક કયા નાટ્યકારની કૃતિ ઉપરથી રચાયેલું છે? - મોલિયેર
૨૪. નવલરામનું કયુ નાટક મોલિયેરના 'મોક ડોક્ટર'નું રૂપાંતર છે? - 'ભટ્ટનું ભોપાળુ'
૨૫. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચકનું નામ જણાવો. - નવલરામ
૨૬. અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાનું નામ જણાવો. - 'કરણઘેલો'
૨૭. 'લલિતાદુઃખદર્શક' નાટકની મુખ્ય નાયિકાનું નામ જણાવો. - લલિતા
૨૮. 'લલિતા દુઃખદર્શક' નાટક કયા યુગની કૃતિ છે ? - સુધારકયુગ
૨૯. 'સાસુવહુની લડાઈ' કયા પ્રકારની નવલકથા છે ? - સામાજિક
૩૦. 'સાસુવહુની લડાઈ' નવલકથાના રચયિતાનું નામ જણાવો. - મહીપતરામ નીલકંઠ
૩૧. ગુજરાતમાં સુધારા પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? - દુર્ગારામ મહેતાજી
૩૨. 'ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન' એ પ્રવાસવર્ણનનું પુસ્તક કોણે આપ્યું છે? - મહીપતરામ નીલકંઠ
૩૩. સાક્ષરયુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? - ગોવર્ધનયુગ
૩૪. 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખકનું નામ જણાવો. - ગોવર્ધનરામ
૩૫. 'સરસ્વતીચંદ્ર'- ભાગ- ૧ ની સાલ જણાવો - ઇ.સ.૧૮૮૭

૩૬. ગોવર્ધનરામનું કયુ દીર્ઘકાવ્ય પત્નીના મૃત્યુ નિમિત્તે સર્જાયું છે? - 'સ્નેહમુદ્રા'
૩૭. કઈ નવલકથાને 'પ્રેમકથાનિમિત્તે' સંસ્કૃતિકથા તરીકે ઓળખવામાં આવે છે? - 'સરસ્વતીચંદ્ર'
૩૮. 'રાઈનો પર્વત' નાટકનાં લેખકનું નામ જણાવો. - રમણભાઈ નીલકંઠ
૩૯. 'સાંઈઆ સે સબ કુછ હોતે હૈ, મુજ બંદે સે કુછ નાહીં, રાઈકો પરબત કરે, પરબત બાગકી માંહી.' -આ દુહો કયા નાટકમાં આવે છે ? - 'રાઈનો પર્વત'
૪૦. અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસિક નવલકથાનું નામ જણાવો. - 'ભદ્રંભદ્ર'
૪૧. રમણભાઈ કૃત ગુજરાતી નાટ્ય સાહિત્યની સીમા ચિન્હરૂપ કૃતિ કઈ છે? - 'રાઈનો પર્વત'
૪૨. 'સરસ્વતીચંદ્ર'- નવલકથાના પ્રથમ ભાગનું શીર્ષક જણાવો. - 'બુધ્ધિધનનો કારભાર'
૪૩. 'રાઈનો પર્વત' નાટકનાં કુલ કેટલા અંક છે? - સાત
૪૪. નરસિંહરાવનો પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો. - 'કુસુમમાળા'
૪૫. નરસિંહરાવના સ્મૃતિચિત્રો કયા પુસ્તકમાં સંગ્રહિત થયેલ છે? - 'સ્મરણમુકુર'
૪૬. 'હૃદયવીણા' ના સર્જકનું નામ જણાવો. - નરસિંહરાવ
૪૭. નરસિંહરાવનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કુસુમમાળા' કઈ સાલમાં પ્રગટ થયો હતો? - ઇ.સ.૧૮૮૭
૪૮. મણિલાલ નભુભાઈના બે નાટકોનાં નામ આપો - 'કાન્તા' અને નૃસિંહાવતાર'
૪૯. મણિલાલ નભુભાઈના બે સામયિકોનાં નામ જણાવો. - 'પ્રિયવંદા' અને 'સુદર્શન'
૫૦. 'કાશ્મીરનો પ્રવાસ' કૃતિનાં રચયિતાનું નામ જણાવો. - કલાપી
૫૧. કલાપીનું મૂળ નામ જણાવો. - સૂરસિંહજી તત્ત્વસિંહજી ગોહિલ
૫૨. 'યુવાનોના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? - કલાપીને
૫૩. 'કાન્તનું મૂળ નામ જણાવો. - મણિશંકર રત્નજી ભટ્ટ
૫૪. 'પૂર્વાલાપ' કાવ્યસંગ્રહનું મુખ્ય આકર્ષણ કયુ છે? - ખંડકાવ્યો
૫૫. કવિ કાન્તના એકમાત્ર કાવ્યસંગ્રહનું નામ જણાવો. - 'પૂર્વાલાપ'
૫૬. ડોલનશેલી સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? - ન્હાનાલાલ
૫૭. 'જયા-જયંત' નાટકનાં સર્જકનું નામ આપો.- ન્હાનાલાલ
૫૮. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સોનેટ સ્વરૂપની શરૂઆત કરનાર સર્જકનું નામ જણાવો.- બ.ક.ઠાકોર
૫૯. બ.ક.ઠાકોર કૃત 'ભણકારા' સોનેટની રચનાસાલ જણાવો. - ઇ.સ.૧૮૮૮
૬૦. બ.ક.ઠાકોરનું ઉપનામ જણાવો. - 'સેહની'
૬૧. 'કલાન્ત કવિ' કાવ્યસંગ્રહનાં સર્જકનું નામ જણાવો. - બાલાશંકર કંથારિયા
૬૨. 'રાઈનો પર્વત' નાટકમાં કનકપુરનાં રાજાનું નામ જણાવો. - પર્વતરાય
૬૩. રમણભાઈએ કયા નાટકમાં સંસ્કૃત - નાટ્યપદ્ધતિ અને અંગ્રેજીનાટ્ય પદ્ધતિનો સમન્વય કર્યો છે? - 'રાઈનો પર્વત'
૬૪. 'કલાપીનો કેકારવ' પુસ્તકના કવિનું નામ જણાવો. - કલાપી
૬૫. 'જયા - જયંત' નાટકનાં મુખ્ય બે પાત્રોનાં નામ જણાવો. - જયા- જયંત